

Enrollment No: \_\_\_\_\_

Exam Seat No: \_\_\_\_\_

# C. U. SHAH UNIVERSITY

## Winter Examination-2019

**Subject Name : Basic Electronics Engineering**

**Subject Code : 2TE02BEE1**

**Branch: Diploma (All)**

**Semester : 2**

**Date : 20/09/2019**

**Time : 02:30 To 05:30**

**Marks : 70**

Instructions:

- (1) Use of Programmable calculator & any other electronic instrument is prohibited.
  - (2) Instructions written on main answer book are strictly to be obeyed.
  - (3) Draw neat diagrams and figures (if necessary) at right places.
  - (4) Assume suitable data if needed.
- 

**Q-1**

**Attempt the following questions:**

**(14)**

- a) Charge of the electron is \_\_\_\_ :
  - A.  $1.602 \times 10^{-19}$  C
  - B.  $1.602 \times 10^{-19}$  A
  - C.  $1.602 \times 10^{19}$  C
  - D.  $1.602 \times 10^{19}$  A
- b) What is the tolerance of resistor having color code Brown -Black - Blue -silver?
  - A.  $\pm 5\%$
  - B.  $\pm 10\%$
  - C.  $\pm 20\%$
  - D.  $\pm 1\%$
- c) Full form of BJT is.....
  - A. Bi Junction Transistor
  - B. Bi Junction Terminal
  - C. Bit Junction Transistor
  - D. Bit Junction Terminal
- d) Ripple factor of full wave rectifier is .....?
  - A. 1.21
  - B. 0.48
  - C. 0.121
  - D. 4.8
- e) Unit of capacitor is.....
  - A. Faraday
  - B. Ohm
  - C. Ampere
  - D. Volt
- f) Bridge wave rectifier contain .....diode
  - A. 1
  - B. 2



- C. 3
- D. 4
- g)** Give full form of PIV for diode.
  - A. Positive Inverse Voltage
  - B. Pick Inverse Voltage
  - C. Positive Inverse Variable
  - D. Pick Inverse Variable
- h)** Which of the following capacitors is polarized?
  - A. plastic-film
  - B. mica
  - C. electrolytic
  - D. ceramic
- i)** Frequency in D.C. voltage is ..... Hz.
  - A. 5
  - B. 10
  - C. 25
  - D. 50
- j)** Which component is not a passive component?
  - A. Diode
  - B. Resistor
  - C. Capacitor
  - D. Inductor
- k)** The unit of resistor is.....
  - A.  $\Omega$
  - B.  $\Omega$  – meter
  - C.  $\Omega$  / meter
  - D.  $\Omega$  /  $m^2$
- l)** Which material has extremely large resistance?
  - A. Semiconductor
  - B. Conductor
  - C. Insulator
  - D. None of the above
- m)** Which components oppose the flow of current?
  - A. Inductor
  - B. Capacitor
  - C. Resistor
  - D. Transistor
- n)** Transistor has ..... no of terminals
  - A. Two
  - B. Three
  - C. Four
  - D. Five

**Attempt any four questions from Q-2 to Q-8**

<b>Q-2</b>	<b>Attempt all questions</b>	<b>(14)</b>
<b>A</b>	Give Classification of resistor. Explain any one classification in detail.	7
<b>B</b>	Explain the working principle of inductor	7
<b>Q-3</b>	Attempt all questions	(14)



<b>A</b>	Enlist the different types of switches with its symbols.	7
<b>B</b>	Describe about these words (1)Peak inverse voltage (2)Doping (3)Rectification efficiency (4) Form factor (5) intrinsic semiconductor (6)Filter (7)Rectifier	7
<b>Q-4</b>	Attempt all questions	(14)
<b>A</b>	Explain 4-band color code system for resistor with one example.	7
<b>B</b>	List different types of fuses and Explain any one in detail	7
<b>Q-5</b>	Attempt all questions	(14)
<b>A</b>	Explain working of NPN transistor with appropriate Diagram.	7
<b>B</b>	Explain Conductor, Semiconductor and Insulator with the help of energy band diagram.	7
<b>Q-6</b>	Attempt all questions	(14)
<b>A</b>	Explain Varactor Diode With Appropriate Diagram	7
<b>B</b>	Explain PN Junction diode as a forward bias and draw characteristics of it.	7
<b>Q-7</b>	Attempt all questions	(14)
<b>A</b>	Derive the relation between current gain parameter $\alpha_{dc}$ & $\beta_{dc}$ .	7
<b>B</b>	What is Connector? Give types of connector and give specification of it.	7
<b>Q-8</b>	Attempt all questions	(14)
<b>A</b>	Explain the working of toggle switch and its types.	7
<b>B</b>	Explain about bridge wave rectifier with circuit diagram & waveform.	7



**Q-1**

**Attempt the following questions:**

**(14)**

- a) ઇલેક્ટ્રોન નો ચાર્જ..... છે
- A.  $1.602 \times 10^{-19}$  C
  - B.  $1.602 \times 10^{-19}$  A
  - C.  $1.602 \times 10^{19}$  C
  - D.  $1.602 \times 10^{19}$  A
- b) બ્રાઉન બ્લેક બ્લુ સીલ્વર કલર કોડ વાળા અવરોધ માટે ટોલન્સ શું છે ?
- A. +/-5%
  - B. +/-10%
  - C. +/-20%
  - D. +/-1%
- c) BJT નું પૂરું નામ ..... છે.
- A. બાઇ જંકશન ટ્રાન્ઝિસ્ટર
  - B. બાઇ જંકશન ટમ્પિનલ
  - C. બીટ જંકશન ટ્રાન્ઝિસ્ટર
  - D. બીટ જંકશન ટમ્પિનલ
- d) ફૂલવેવ રેઝિટ્રાયરનો રીપલ ફેક્ટર..... છે.
- A. 1.21
  - B. 0.48
  - C. 0.121
  - D. 4.8
- e) કેપેસીટર નો એકમ ..... છે
- A. ફેરેડ
  - B. ઓહમ
  - C. એમ્પીયર
  - D. વોલ્ટ
- f) બ્રીજ વેવ રેકટીફિયર પાસે ..... ડાયોડ હોય છે.
- A. 1
  - B. 2
  - C. 3
  - D. 4
- g) ડાયોડ માટે PIV નું પૂરું નામ આપો.
- A. પોઝિટીવ ઇન્વર્સ વોલ્ટેજ
  - B. પીક ઇન્વર્સ વોલ્ટેજ
  - C. પોઝિટીવ ઇન્વર્સ વેરીએબલ
  - D. પીક ઇન્વર્સ વેરીએબલ
- h) નીચેના મા થી કયા કેપેસિટર્સ નું ધૂવીકરણ થાય છે ?
- A. પ્લાસ્ટિક ફિલ્મ
  - B. અબરામ
  - C. ઇલેક્ટ્રોલાઇટ



D. સિરામિક

- i) ડીસી વોલ્ટેજમાં આવર્તન ..... હ્ટેડ છે.
- A. 5  
B. 10  
C. 25  
D. 50
- j) ક્યુ કમ્પોનન્ટ પેસિવ કમ્પોનન્ટ નથી?
- A. ડાયોડ  
B. અવરોધ  
C. કેપેસીટર  
D. ઇન્ડક્ટર
- k) અવરોધ નો એકમ ..... છે.
- A.  $\Omega$   
B.  $\Omega$  – meter  
C.  $\Omega / \text{meter}$   
D.  $\Omega / \text{m}^2$
- l) કયા મટીરીયલ ને અત્યંત મોટો અવરોધ હોય છે?
- A. અર્દ્ધ – વાહક  
B. વાહક  
C. અવાહક  
D. કોઇ નહીં
- m) ક્યો ઘટક પ્રવાહનો વિરોધ કરે છે?
- A. ઇન્ડક્ટર  
B. કેપેસીટર  
C. રેઝિસ્ટર  
D. ટ્રાન્ઝિસ્ટર
- n) ટ્રાન્ઝિસ્ટરને..... ટમિનલ હોય છે.
- A. બે  
B. ત્રણ  
C. ચાર  
D. પાંચ

Attempt any four questions from Q-2 to Q-8

Q-2	Attempt all questions	(14)
A	અવરોધનું વગ્નિકરણ કરો. કોઇ પણ એક વગ્નિકરણ વિસ્તારમાં સમજાવો.	7
B	ઇન્ડક્ટર નો કાર્ય સિદ્ધાંત સમજાવો.	7

Q-3	Attempt all questions	(14)
-----	-----------------------	------



<b>A</b>	જુદા જુદા પ્રકાર ની સ્વીચ અને તેના સીમ્બોલ નું લિસ્ટ બનાવો.	7
<b>B</b>	આપેલા શબ્દો વર્ણનો (1)પીક ઇંવર્શ વોલ્ટેજ (2)ડોપીન્ડા (3)રેક્ટીફિકેસન એફીસીયંસી (4) ફોર્મ ફેક્ટર (5) ઇન્સ્ટ્રીક સેમીકન્ડકટર (6)ફીલ્ટર (7)રેક્ટીફાયર	7
<b>Q-4</b>	Attempt all questions	(14)
<b>A</b>	એક ઉદાહરણ સાથે રેઝિસ્ટરનું 4 બેન્ડ કલર કોડ સિસ્ટમ સમજાવો.	7
<b>B</b>	વિવિધ પ્રકારના ફ્યુઝ વિશે નું લિસ્ટ બનાવો અને કોઈ એક વિસ્તાર થી સમજાવો.	7
<b>Q-5</b>	Attempt all questions	(14)
<b>A</b>	NPN ટ્રાન્ઝિસ્ટર નું કાર્ય યોગ્ય આફુતિ સાથે સમજાવો	7
<b>B</b>	અવાહક, અધ્ય - વાહક અને વાહક નો એનજી બેંડ ડાયાગ્રામ દોરો અને સમજાવો.	7
<b>Q-6</b>	Attempt all questions	(14)
<b>A</b>	યોગ્ય આફુતિ સાથે વેરેક્ટર ડાયોડ સમજાવો	7
<b>B</b>	PN જંકશન ડાયોડ માટે ફોરવર્ડ બાયસ સમજાવી તેની કેરેક્ટરીસીક્સ દોરો.	7
<b>Q-7</b>	Attempt all questions	(14)
<b>A</b>	કરંટ ગેઇન પેરમીટર $\alpha_{dc}$ & $\beta_{dc}$ વચ્ચેનો સંબંધ તારવો.	7
<b>B</b>	કનેક્ટર એટલે શું? કનેક્ટર ના પ્રકાર લખી તેના માટેના સ્પેશીઝીકેન લખો.	7
<b>Q-8</b>	Attempt all questions	(14)
<b>A</b>	ટોગલ સ્વીચ નું કાર્ય અને તેના પ્રકારના સમજાવો.	7
<b>B</b>	જરૂરી આફુતિ અને વેવ ફોર્મ ની સાથે બ્રીજ રેફિન્ફાયર સર્કિટ સમજાવો	7

